

LD-111

April-2014

B.Sc. Sem.-VI
CC-307 : Physics**(Mathematical Physics, Classical Mechanics and Quantum Mechanics)****Time : 3 Hours]****[Max. Marks : 70]****સૂચના :** (1) બધા જ પ્રશ્નોના ગુણ સરખા છે.**Instructions :** All questions carry equal marks.

(2) સંજ્ઞાઓ તેમના પ્રયત્નિત અર્થમાં છે.

Symbols have their usual meanings.

1. (અ) જો 'v' પૂર્ણાંક ન હોય તો દર્શાવો કે $W[Jv(x), J_{-v(x)}] = \frac{-2\sin \pi v}{\pi x}$

7

Show that $W[Jv(x), J_{-v(x)}] = \frac{-2\sin \pi v}{\pi x}$ if 'v' is not an integer.

અથવા/OR

v = n પૂર્ણાંક માટે સાબિત કરો કે :

For v = n an integer, show that :

$$(1) J_{v-1}(x) + J_{v+1}(x) = \frac{2v}{x} J_v(x)$$

$$(2) J_{v-1}(x) - J_{v+1}(x) = 2J'_v(x)$$

(બં) સાબિત કરો કે $J_m(x) = \frac{1}{\pi} \int_0^{\pi} \cos(m\theta - x \sin \theta) d\theta$

7

Prove that $J_m(x) = \frac{1}{\pi} \int_0^{\pi} \cos(m\theta - x \sin \theta) d\theta$

અથવા/OR

દર્શાવો કે :

Show that :

$$(1) x P'_l(x) - l P_l(x) = P'_{l-1}(x)$$

$$(2) x P'_{l-1}(x) + l P_{l-1}(x) = P'_l(x)$$

2. (અ) જીડોકેસીક્સ સમજાવો. ગોલીય સપાઈના જીડોકેસીક્સ ગુરુ વર્તુળો છે. તેમ દર્શાવો. 7

Explain geodesic. Show that the geodesic of spherical surface are great circles.

અથવા/OR

લઘુત્તમ સમયનો કોયડો વર્ણિવો. આ કોયડો કેવી રીતે ઉકેલાય છે તે સવિસ્તર સમજાવો.

Describe shortest time problem. How this problem can be solved ? Explain in detail.

- (બ) વીજયાંત્રિક સરખામણી (electromechanical analogies)ને આધારે LCR શ્રેષ્ઠ પરિપथ અને LCR સમાંતર પરિપથ માટે લાગ્રાન્જિયન મેળવો. 7

Obtain Lagrangian for series LCR and parallel LCR electric circuit on the basis of electro-mechanical analogies.

અથવા/OR

l ત્રિજ્યા ધરાવતા લીસા ગોલક (smooth sphere) પર ગુરુત્વાકર્ષણની અસર નીચે m દ્વયમાન ધરાવતો કણ ગતિ કરે છે. લાગ્રાન્જિના અનિધર્તિત ગુણાંકની મદદથી ગોલકની સપાઈ પરથી કણ માટેનો “flies off” ખૂણો શોધો (સપાઈનું ઘર્ષણ અવગણો).

A particle of mass m is moving under the action of gravity on the surface of smooth sphere of radius l . Apply Lagrangian method of undetermined multiplier to find out the angle at which the particle “flies out” of the surface. (neglect surface friction)

3. (અ) હાઇડ્રોજન આણુ માટે ત્રિજ્યાવર્તી શ્રોડીન્જર સમીકરણ લખો. આયગન મૂલ્યો મેળવવા માટે ત્રિજ્યાવર્તી સમીકરણ ઉકેલો. 7

Write radial schrodinger's equation for hydrogen atom. Solve radial equation for getting eigen values.

અથવા/OR

સમદિકધમી દોલક (Isotropic Oscillator) માટે ત્રિજ્યાવર્તી તરંગ સમીકરણ લખો. આ સમીકરણનો ઉપયોગ કરીને સમદિકધમી દોલક માટે આયગન મૂલ્ય અને આયગન વિધેય મેળવો.

Write the radial schrodinger equation for isotropic oscillator and solve this equation to derive the eigen values and eigen functions of isotropic oscillator.

- (બ) ત્રિ-પારિમાળિક સ્થિતિમાન ફૂપ વ્યાખ્યાપિત કરો અને ફૂપના અંતર્ગત ભાગ (Interior region)માં ત્રિજ્યાવર્તી શ્રોડીન્જર સમીકરણનો ઉકેલ મેળવો. 7

Define three dimensional square well potential and obtain the solution of radial schrodinger equation in its interior region.

અથવા/OR

સમાન ચુંબકીય ક્ષેત્રમાં વિજભારીત કણ માટેના શક્તિવર્ણિકાનું અને આયગન વિધેયોની ચર્ચા કરો.

Discuss the energy spectrum and eigen functions for a charged particle in a uniform magnetic field.

4. (અ) (1) અવરસ્થા સદિશ (State Vector) નિરૂપણ સમજાવો.

7

Explain the representation of State Vectors.

- (2) ગતિકીય ચલો (dynamical variables)નું શૈખિક સંકારકો (Matrix Operators)ના સ્વરૂપમાં નિરૂપણ સમજાવો અને દર્શાવો કે

Discuss the representation of a dynamical variables as Matrix operator and show that

$$(x)_A = [F]_A (\Psi)_A$$

અથવા/OR

શ્રોડિન્જર નિરૂપણ (schrodinger representation)ની ચર્ચી કરો અને બતાવો કે

Explain the schrodinger representation and show that

$$\langle x | \hat{P} | \Psi \rangle = -i\hbar \frac{\partial \Psi(x)}{\partial x}$$

- (બ) યામતંત્રના રેખીય સ્થાનાંતર પ્રેરીત એકેક્ય રૂપાંતરણ માટે દર્શાવો કે $|x\rangle' = e^{-i\varepsilon_j \hat{P}_x / \hbar} |x\rangle$

7

Show that $|x\rangle' = e^{-i\varepsilon_j \hat{P}_x / \hbar} |x\rangle$ for unitary transformation induced by translation of co-ordinate system.

અથવા/OR

યામ સંહતિના પ્રમાણાથી પ્રેરીત એકેક્ય રૂપાંતરણ પર સાફિસ્તર ચર્ચી કરો. બતાવો કે

Discuss in detail the unitary transformation induced by rotation of co-ordinate system. Show that

$$[\Sigma_x, \Sigma_y] = i \Sigma_z$$

5. ટૂકમાં જવાબ આપો :

14

Answer in short :

- (1) ન્યુમાન વિધેય (Neumann function) લખો.

Write Neumann function.

- (2) હેન્કલ વિધેય (Hankel Function)

Write Hankel functions

$$(i) H_v^{(1)}(x)$$

$$(ii) H_v^{(2)}(x)$$

- (3) બેસેલ વિધેય માટે લંબછેદકીય સંબંધ (Orthogonality relation) લખો.
Write orthogonality relation for Bessel's function.
- (4) લીજેન્ડ્ર વિકલન સમીકરણ લખો.
Write Legendre differential equation.
- (5) વિન્યાસ અવકાશ (configuration space) વ્યાખ્યાપિત કરો.
Define configuration space.
- (6) એરીલર-લગ્રાંજેન્ઝુનું સમીકરણ લખો.
Write Euler-Lagrange's equation.
- (7) હૈમિલ્ટનનો સિદ્ધાંત લખો.
State Hamilton's principle.
- (8) હોડોગ્રાફ (Hodograph) વ્યાખ્યાપિત કરો.
Define Hodograph.
- (9) અવસ્થા વિધેય (state vector) વ્યાખ્યાપિત કરો.
Define state vector.
- (10) હિલબર્ટ અવકાશ (Hilbert Space) વ્યાખ્યાપિત કરો.
Define Hilbert Space.
- (11) \hat{x} અને \hat{P} વચ્ચેની કવોન્ટમ શરત લખો.
Write quantum condition between \hat{x} and \hat{P}
- (12) ગેજ ટ્રાન્સફોર્મેશન (Gauge Transformation) એટલે શું ?
What is Gauge Transformation ?
- (13) ગોળીય ધૂવીય યામો (Spherical Polar co-ordinates) અને પેરાબોલિક (Parabolic) યામ વચ્ચેનો સંબંધ લખો.
Write relation between Spherical Polar Co-ordinates and Parabolic Co-ordinates.
- (14) બીટા ક્ષયની પ્રક્રિયામાં પેરીટીનું સંરક્ષણ થાય છે કે નહીં ?
Does parity is conserved in the process of beta decay ?
-